



ગુજરાત જાહેર સેવા આયોગ

અગત્યની જાહેરાત (Important Notice)

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા. ૧૪.૧૦.૨૦૨૧ ના જાહેરનામા ક્રમાંક: NO/GS/18/2021/CRR/11/2021/450900/G.5 થી સીધી ભરતી અન્વયે ઉમેદવારોની વયમર્યાદામાં તા. ૦૧.૦૯.૨૦૨૧ થી ૩૧.૦૮.૨૦૨૨ સુધી ૧ વર્ષનો વધારો કરવામાં આવેલ છે. (વધુમાં વધુ ૪૫ વર્ષ સુધી) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૨૧.૦૯.૨૦૨૧ ના રોજ જાહેરાત ક્રમાંક: ૨૩/૨૦૨૧-૨૨ થી ૩૦/૨૦૨૧-૨૨ નીચે દર્શાવ્યા મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આથી આ જાહેરાતો માટે ઉપલી વય મર્યાદામાં વધારો કરવાનો થાય છે. આ હેતુ માટે જાહેરાત ક્રમાંક: ૨૩ થી ૩૦/૨૦૨૧-૨૨, તા. ૧૬.૧૦.૨૦૨૧ (૧૩:૦૦ કલાક) થી ૨૬.૧૦.૨૦૨૧ (૧૩:૦૦ કલાક) સુધી રી-ઓપન (Re-open) કરવાનો આયોગે નિર્ણય કરેલ છે.

જાહેરાત ક્રમાંક	જગ્યાનું નામ	જગ્યાની સંખ્યા	પ્રાથમિક કસોટીની તારીખ
૨૩	જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨ (GMC)	૦૧	૨૬.૧૨.૨૦૨૧
૨૪	પ્લાનીંગ આર્કિટેક્ટ, વર્ગ-૩ (GMC)	૦૨	૦૨.૦૧.૨૦૨૨
૨૫	મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક, વર્ગ-૨	૦૬	૨૬.૧૨.૨૦૨૧
૨૬	નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ-૧	૧૩	૨૬.૧૨.૨૦૨૧
૨૭	વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-૨	૦૬	૦૯.૦૧.૨૦૨૨
૨૮	આચાર્ય, આદર્શ નિવાસી શાળા(વિ.ખ.), વર્ગ-૨	૦૧	૦૨.૦૧.૨૦૨૨
૨૯	પ્રવર ઔષધ નિરીક્ષક, વર્ગ-૨ (ખાસ ભરતી)	૦૩	૦૨.૦૧.૨૦૨૨
૩૦	ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલકી સેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨	૧૮૩	૧૯.૧૨.૨૦૨૧

હવે આ જાહેરાતો માટે ઉપલી વયમર્યાદા નીચે મુજબ રહેશે.

કેટેગરી	બિન અનામત	આ.ન.વ. (EWS), સા.શૈ.પ.વ. (SEBC), અ.ખ. (SC), અને અ.જ.ખ. (ST)
પુરુષ ઉમેદવારો માટે	૩૬ વર્ષ	૪૧ વર્ષ
સ્ત્રી ઉમેદવારો માટે	૪૧ વર્ષ	૪૫ વર્ષ

- જે ઉમેદવારોએ આ જાહેરાતો માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે તા. ૧૩.૧૦.૨૦૨૧ સુધીમાં Online અરજી કરી દીધી છે, તેમણે હવે પુનઃ અરજી કરવાની રહેતી નથી. જે ઉમેદવારો હવે ઉપલી વયમાદામાં છૂટ છાટ મળવાને કારણે પાત્ર થાય છે અથવા જે ઉમેદવારો અરજી કરવાની ચૂકી ગયા છે તેમણે જ Online અરજી <https://gpsc-ojas.gujarat.gov.in> કરવાની રહેશે.
- અરજી કરતા પહેલાં ઉમેદવારોએ આયોગની વેબસાઇટ <https://gpsc.gujarat.gov.in> પર પ્રસિધ્ધ થયેલ વિગતવાર જાહેરાતની તમામ બેગવાઇઓનો અભ્યાસ કરવાનો રહેશે અને તે પ્રમાણે અરજી કરવાની રહેશે.
- ઉપલી વયમાદા માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ છેલ્લી તારીખ એટલે કે તા. ૧૩.૧૦.૨૦૨૧ ધ્યાને લેવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ છેલ્લી તારીખ એટલે કે તા. ૧૩.૧૦.૨૦૨૧ ધ્યાને લેવામાં આવશે.
- નોન કિમીલેયર સર્ટિફિકેટ (NCLC) અને આર્થિક રીતે નબળા વર્ગોમાં સમાવેશ થવા બાબતે (EWS) ના સર્ટિફિકેટ માટે જાહેરાતની બેગવાઇઓને આધીન ઇસ્તુ તારીખ ૨૬.૧૦.૨૦૨૧ સુધી ધ્યાને લેવામાં આવશે.
- અન્ય તમામ બાબતો માટે મૂળ જાહેરાતમાં દર્શાવેલ બેગવાઇઓ ધ્યાને લેવાની રહેશે.

અરજી કરતી વખતે ધ્યાને લેવાની સૂચનાઓ.

૧. ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી “Editable” છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી. ઓનલાઇન કરેલ અરજીમાં વિગત-માહિતી ભરવામાં કોઈ ભૂલ થાય તો “Edit” વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી, ફોટો અને અન્ય વિગતો ચકાસી તેની ખરાઈ કરવી, જે ભૂલ હોય તો સુધારો કરી લેવા જણાવવામાં આવે છે. જાહેરાત ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં.
૨. (૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઇન અરજી કરવી. ઓન-લાઇન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.

(૨) કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ કે ચૂક બાબતે સુધારો કરવાની જરૂરીયાત જણાય તો <https://gpsc-ojas.gujarat.gov.in> ના “Online Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના છેલ્લા દિવસ-સમય સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમયપૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં.

(૩) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફ્રી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

(૪) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે.

(૫) ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક/પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. ANNEXURE-‘A’ (ENGLISH) માન્ય ગણાશે નહીં.

ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ ૨૬.૧૦.૨૦૨૧ ના ૧૩:૦૦ કલાક સુધી જ વેબસાઇટ ખુલી રહેશે માટે આખરી દિવસો સુધી રાહમાં નહિ રહેતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજિયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

તા. ૧૪.૧૦.૨૦૨૧
ગાંધીનગર

સંયુક્ત સચિવ
ગુજરાત જહેર સેવા આયોગ